

PANTH Infinity INTENDED TO INSPIRE

4th November, 2020

To.

The Corporate Relations Department

BSE Limited

PhirozeJeejeebhoy Towers,

Dalal street.

Mumbai-400001, Maharashtra.

BSE Code: 539143

To.

The Listing Department

The Calcutta Stock Exchange Limited

7, Lyons Range, Dalhousie, Murgighata, B B D Bagh, Kolkata-700001, West Bengal.

CSE Code: 30010

Sub: Newspaper advertisement of Notice of Board Meeting to be held on 11/11/2020 for approving Unaudited Financial Results for the Quarter and Half year ended 30/09/2020.

Dear Sir/Madam.

Pursuant to the provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a copy of Newspaper Advertisement published in "Financial Express" (English) and "Gujarat Guardian" (Gujarati) newspaper on 4th November, 2020 for the notice of Board Meeting to be held on Wednesday, the 11th November, 2020 to consider and approve, inter-alia, the Unaudited Financial Results for the Quarter and Half Year ended 30th September, 2020.

Kindly take the same on your record and oblige.

Thanking you.

Yours faithfully,

For PANTH INFINITY LIMITED

JINAY KORADIYA

Chairman & Managing Director

DIN: 03362317


Encl.: As above



PANTH INFINITY LIMITED | CIN: L45201GJ1993PLC114416

Registered Office: 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Haripura, Surat-395003, Gujarat.





SINTEX INDUSTRIES LIMITED SINTEX CIN: L17110GJ1931PLC000454 Regd. Office: Kalol (N.G.) - 382 721, Dist: Gandhinager, Gujarat, India. Ph.: +91-2764-253000, E-mail: share@sintex.co.in, Website: www.sintex.in

NOTICE

NOTICE is hereby given that pursuant to Regulation 29 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday, November 10, 2020, inter alia, to consider and approve the Unaudited Financial Results of the Company for the Second Quarter and half year ended 30th September, 2020. A copy of the said notice and Financial Results on approval shall also be available on Company's website at www.sintex.in and also on Stock Exchange's website at www.bseindia.com and www.nseindia.com.

Place: Kalol (N.G.) Date: 03-11-2020

For Sintex Industries Limited Hitesh T. Mehta Company Secretary

PANTH INFINITY LIMITED

CIN: L45201GJ1993PLC114416 Reg. Office: 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Haripura, Surat - 395003, Gujarat, India. E-mail: info@panthinfinity.com, website: www.panthinfinity.com NOTICE

NOTICE is hereby given that pursuant to Regulation 47(1)(a) and 29(1)(a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Meeting No. 5/2020-21 of the Board of Directors of the Company is scheduled to be held on Wednesday, the 11th November, 2020 at 2:00 p.m. at the Registered Office of the Company situated at 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Haripura, Surat - 395003, Guiarat, India, inter-alia, to consider and approve Unaudifed Financial Results for the Quarter and Half Year ended 30th September, 2020 The Notice is also available on the Company's website www.panthinfinity.com and or

the website of the Stock Exchanges www.bseindia.com and www.cse-india.com.

For PANTH INFINITY LIMITED Sd/-

Place: Surat Date: 03/11/2020

JINAY KORADIYA Chairman and Managing Director DIN: 03362317

SHRI JAGDAMBA POLYMERS LIMITED

CIN: L17239GJ1985PLC007829 Registered Office: 802 Namarayan Complex, Opp. Navrangpura, Post Office, Navrangpura, Ahmedabad-380009, Gujarat. E-mail Id: admin@jagdambapolymers.com Website: www.shrijagdamba.com

Tel No. 079-26565792 NOTICE

NOTICE is hereby given pursuant to Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015 that the Board of Directors meeting of SHRI JAGDAMBA POLYMERS LIMITED will be held on Thursday November 12, 2020 at the registered office of the company for consideration of Unaudited quarterly results along with Limited review report for Quarter and Half year ending on September 30, 2020. 2. Any other Matter which the Board deems fit, with the permission of the Chairman. Information in this regard is also available on the website of the company i.e. www.shrijagdamba.com and on the website of stock exchange i.e. www.bseindia.com

Also note that the trading window shall remain close till 48 hours after the result pursuant to the meeting made public.

For, Shri Jagdamba Polymers Limited SD/-Date: 03.11.2020 Kunjal Soni Place: Ahmedabad Company Secretary

GOPALA POLYPLAST LIMITED.

(CIN:- L25200GJ1984PLC050560) Reg. Office: - Plot No. 485, Santej Vadsar Road, Santej, Tal. Kalol, Dist.

Gandhinagar-Gujarat - 382721 Corporate Office: - H B Jirawala House, 13 Nav Bharat Society, Opp. Panchsheel Bus Stop, Usmanpura, Ahmedabd-13

Public Notice

Notice is hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Board of Directors of the company in consultation with BSE Limited, has fixed Wednesday, November 11, 2020 as the Record Date for giving the effect of Reduction of Share Capital as per the Resolution Plan duly approved by the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench, vide its order dated August 07, 2020 under section 30(6) of the Insolvency and Bankruptcy Code (IBC) 2016.

The details of Reduction of Share Capital are as under-

S. No.	Share holding of Erstwhile Promoters & Promoter Group	Remarks Entire 30,17,309 Equity Shares of Rs 10/- shall stand cancelled & reduced to Zero (0). Entire 4,80,000 Preference Shares of Rs. 100/- each shall stand cancelled & reduced to Zero (0).		
1				
issued in lieu of every exis Shares of Rs.10/- each held		1 Equity Share of Rs.10/- each to be issued in lieu of every existing 32 Equity Shares of Rs.10/- each held by the Public share holders and Fraction shares shall reduced to zero (0).		

For Gopala Polyplast Limited Khushboo Surana Date: 03-11-2020 (Company Secretary) Place: Ahmedabad

RIDDHI SIDDHI GLUCO BIOLS LIMITED

CIN: L24110GJ1990PLC013967 Regd. Office: 10, Abhishree Corporate Park, Nr. Swagat Bunglows BRTS Busstand, Ambli-Bopal Road, Ambli, Ahmedabad, Gujarat-380058. Phone: 02717-298600-602, email: ahmd@riddhisiddhi.co.in

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is Scheduled to be held on Tuesday, 10th November, 2020, to, inter alia, consider and approve the unaudited standalone and consolidated financial results of the Company for the quarter and half year ended 30th

The said notice may be accessed at the Company's website at www.riddhisiddhi.co.in and of Stock Exchange's website at www.bseindia.com.

For Riddhi Siddhi Gluco Biols Limited Place: Ahmedabad Company Secretary Date: 02/11/2020 Mem. No. A57221



GOKUL REFOILS AND SOLVENT LIMITED

Regd.Office: State Highway No.41 Nr. Sujanpur Patia, Sidhpur-38415 Corporate Office: "Gokul House", 43, Shreemali Co-operative Housing GOKUL Society Ltd, Opp. Shikhar Building, Navrangpura, Ahmedabad- 380009 CIN: L15142GJ1992PLC018745 Website: www.gokulgroup.com

NOTICE Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Meeting of the Board of Directors of GOKUL REFOILS AND SOLVENT LIMITED will be held on Tuesday, 10" November, 2020 at the Bahuchar Krupa Bungalow, Road Behind SMS Hospital. Near Tapovan Circle, Ahmedabad, 382424 interalia to consider and to approve Standalone and Consolidated Unaudited Financial Results and cash flow statement for the Second quarter and half year ended on 30" September, 2020 along with various other businesses. This Information is posted on Company's website at www.gokulgroup.com and BSE website at www.bseindia.com and NSE website at For, Gokul Refoils and Solvent Limited www.nseindia.com.

Place: Ahmedabad Abhinav Mathur Date: 03.11.2020 Company Secretary



Stressed Assets Management Branch,

1st Floor, Kamdhenu Complex, Panjarapole Cross Road, Ambawadi, Ahmedabad-15 Email samahm@bankofbaroda.co.in

POSSESSION NOTICE

(FOR IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the authorized officer of the BANK OF BARODA under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 28.12.2018 calling upon the borrower M/s H.M.Industrial Pvt. Ltd. (CIN No. U27205GJ2016PTC092510) to repay the amount mentioned in the notice being Rs.11100.59 Lakhs (Rupees One Hundred Eleven Crore Fifty Nine Thousand only) and interest thereon w.e.f. 28.12.2018 within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to M/s H.M.Industrial Pvt. Ltd. (CIN No. U27205GJ2016PTC092510 and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 29th day of October of the year 2020

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property/les will be subject to the charge of Bank of Baroda, Kapadwanj Branch, Kapadwanj for an amount of Rs.11351.93 Lakhs (Rupees One Hundred Thirteen Crore Fifty One Lakhs Ninety Three Thousand only)

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Non Agricultural property being the first floor Shop / Office No. 9 to 16 situated on the first floor of the building commercial complex known as National Plaza constructed on land bearing property No.6653-6654 paiki of town / Ta Kapadwani Dist. Kheda along with the building constructed there on owned by Mr. Harpal Suresh Bhai Patel.

Date: 29th October 2020 **Authorized Officer** Place: Kapadwanj BANK OF BARODA



इंडियन वेक 🗥 🔉 Indian Bank

▲ इलाहाबाद

ALLAHABAD

Branch: University Road, Rajkot, Ambition" Feet Ring Road, Near Indira Circle, Rajkot. Ph No. 0281-2589071

For the Indian Intelligent,

E - AUCTION NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES [See proviso Rule 8 (6)]

Authorised Officer, Indian Bank

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s and Mortgagor/s that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, the Physical/Symbolic Possession of which has been taken by the Authorised Officer of Indian Bank, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on the date mentioned below for recovery of due to the Secured Creditor from the below mentioned Borrower/s and Guarantor/s Borrower/s and Guarantor/s and Mortgagor/s. The reserve price and the earnest money deposit and short description of immovable property are also mentioned hereunder "The borrowers attention is invited to the provision of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

Sr. No.	Name of Borrowers/ Guarantor/Mortgagor (s) & Branch Name Detailed description of the Property		Amount of Secured debt	Reserve Price
1	Shri Jaysan Vinodbhai Sidapara (Applicant) Shri Jaysan Vinodbhai Sidapara (Applicant/Mortgagor) Kantaben V Sidapara (Guarantor) Branch: University Road	All that part and percel of the property consisting Residential Flat No. 401, Land Admsqmtr 53-24 on the 4th floor, flat of building name Royal Homes 2, constructed on land Plot No. 8 and 9, total land Adm.sq.mtr 588-53 of village: Haripar(pal), R.S. No 56/1-7 paiki area known as Green Hills Park, Dist Rajkot in the state of Gujarat. Boundaries: North: Margin Space then Road, South: Stair & Flat No 402, East: Margin Space then road, West: Flat No 404.	Rs. 12,88,138.87 as per Demand Notice dated 01.08.2019 plus interest till the date of realization & costs, charges and expenses.	Rs. 17.20 Lacs
2	M/s Hariom Metals (Borrower) Mr. Maulik B Upadhyay (Borrower and Mortgagor) Mrs. Zarna Upadhyay (Co-Borrower & Guarantor) Mr. Bhadrik Upadhyay (Guarantor) Mr. Rajnikant Jaysukhlal Vyas (Guarantor & Mortgagor) Branch: University Road	Property 1 - All that part and parcel of the property consisting Flat No. 32, Third Floor, Shree Apartment, Plot No. 169/4 & 170 paikee, R S No. 431 & 432 paikee, CSW No. 15, CS. No. 2765, Opposite Railway Tracks, Near Priya Apartment & Ajmera Apartments, Sardamagar Area, Rajkot Boundaries: On the North by: Other's Property, On the South by: Passage, On the East by: Flat No. 33, On the West by: Flat No. 31 and Stair Case. Property 2 - Block & Plot No. 45-54/11, R S No. 383. P 3, Vrundavan Park-4, "Aavkar Residency" Behind Divya Cotton Ginning, off Gondal byepass towards Jetpur, Gondal Boundaries: On the North by: Property of Plot No. 45 to 54/10 that side measurement is 13-80 mtr, On the South by: Property of Plot No. 45 to 54/12 that side measurement is 13-80 mtr, On the East by: 7-50 mtr wide road that side measurement is 3-78 mtr, On the West by: Plot no. 30 to 47/6.	Rs. 4634200.00 as per Demand Notice dated 22.06.2016 plus interest till the date of realization & costs, charges and expenses.	Rs.11.76 Lacs & Rs. 15.78 Lacs
Ea	rnest Money Deposit :	10% of Reserve Price.	For further details	
	Last Date & time for Submission of Process compliance Form with EMD amount : On 18/11/2020 up to 4.00		Terms & Conditions, Contact	
P.M. E-auction through https://www.mstcecommerce.com Registration should be completed by Intending bidder on or before EMD Date and there should be EMD balance in global wallet.		Mr. Kishore S Damle Ph : 0281-2234362, Mob : 9427616319		
_	Auction Date :- On 20/11/	2020, Between 11.00 A.M to 03.00 P.M. with unlimited extension.	E-mail: universityroad@indianb	ank.co.in

Bid Incremental Value is Rs. 10000 Detail of encumbrance, if any known to the Bank - There is no encumbrance on the property described herein to the

Important note for the prospective bidders :- Bidder has to complete following formalities well in advance : Step 1 : Bidder/Purchaser Registration: Bidder to register on e-Auction portal (link given above) http://www.mstcecommerce.com (i.e, https://www.mstcecommerce.com/ auctionhome/ibapi/) using his mobile number and email-id. Step 2: KYC Verification: Bidder to upload requisite KYC documents. KYC documents shall be verified by e-auction service provider (may take 2 working days). Step 3: Transfer of EMD amount to his Global EMD Wallet: Online/off-line transfer of fund using NEFT/Transfer, using challan generated on e-Auction portal.

Step 1 to Step 3 should be completed by bidder well in advance, on or before EMD date. For downloading further details and Terms & Conditions, please visit:

best of knowledge & information of the Authorized Officer.

1. https://www.indianbank.in, 2. https://www.mstcecommerce.com, 3. https://www.ibapi.in

Note: This is also a notice to the Borrower/Guarantors/Mortgagors of the above said loan about holding of this sale on the above mentioned date and other details.

Date: 04.11.2020, Rajkot

financialexp.epapr.in

ADD-SHOP E-RETAIL LIMITED

(FORMERLY KNOWN AS ADD-SHOP PROMOTIONS LIMITED)

CIN: L51109GJ2013PLC076482

Registered office: B-304, Imperial Height, 150ft Ring Road, Rajkot - 360005 Email: investors@addshop.co Tel, No.: 0281-2580399 Web; www.addshop.co

NOTICE The Meeting of the Board of Directors of Add-Shop E-Retail Limited is scheduled to be held on Wednesday, 11" November, 2020 at the registered office of the Company situated at B-304, Imperial Height, 150 Feet Ring Road, Rajkot - 360005, Guiarat, inter alia, to consider & approve the Un-audited Financial Results of the Company for the quarter and Half Year ended September 30, 2020 and to transact any other business with the permission of chairman. This said information is also available on the company's website at www.addshop.co and may also be available on the website of the stock exchange at www.bseindia.com.

> For, Add-Shop E-Retail Limited Dinesh B. Pandya Managing Director(DIN: 06647303)



(U) Uniphos Enterprises Limited

CIN: L24219GJ1969PLC001588

Regd. Office: 11, G.I.D.C., Vapi, Dist.: Valsad - 396 195, Gujarat.

Unaudited Financial Results for the Quarter/Six months ended 30th September, 2020 (Rs. In Lakhs) Six months ended Quarter ended Year ended **Particulars** 30-09-2020 30-06-2020 30-09-2019 30-09-2020 30-09-2019 31-03-2020 Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited Total income from operations 90.03 90.03 22.68 2,340.54 25.24 1,984.79 2,005.31 Net Profit / (loss) for the period before tax and exceptional items. 2,365.78 2,042.70 2,339.96 25.11 1,969.50 2,365.07 1,984,31 2,007.44 Net Profit / (loss) for the period after tax Total Comprehensive Income for the period (Comprising profit for the period (after tax) 31,815.82 38,268.19 10,294.65) 70,084.01 (15,052.19) ,17,982.96) and Other Comprehensive income (after tax)} 1,390.92 Equity Share Capital 1,390.92 1,390.92 1,390.92 1,390.92 1,390.92 Earnings Per Share (of Rs. 2/- each)

The above is an extract of the detailed format of Quarterly / Six monthly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company at www.uelonline.com and may also be accessed on the website of the Stock Exchanges, i.e. BSE Limited (BSE) at www.bseindia.com and National Stock Exchange of India Limited (NSE) at www.nseindia.com, where the equity shares of the Company are listed.

Note: The above unaudited financial results were reviewed by the Audit Committee and thereafter approved at the meeting of the Board of Directors held on 3" November, 2020.

For Uniphos Enterprises Limited Rajnikant Devidas Shroff Chairman and Managing Director (DIN:00180810)

CRESCENT FINSTOCK LIMITED

Registered Office: A/12, Sneh Kuni CHS,

Residential Plot No. 374, Koparli Road, GIDC,

Vapi, Gujarat - 396195

Corporate Office: 11 Floor, Kohinoor City Mail.

Premier Road, Kurla West, Mumbai - 400 070.

Email: crescentfinstock@yahoo.com;

Website: www.crescentfinstock.com

NOTICE OF THE BOARD MEETING

NOTICE pursuant to Regulation 47 of SEBI (Listing

Obligations and Disclosure Requirements) Regulations

2015, be and is hereby given that the meeting of the

Board of directors of the Company will be held on

Thursday, November 12, 2020 to consider the

n-audited financial results (Standalone i

Consolidated) of the Company under the Indian

Accounting Standards (Ind AS) for the guarter and half

For Crescent Finstock Limited

Chandramohan G. Jakhmoli

ATUL AUTO LIMITED

Wholetime Director

DIN: 08005196

year ended as on September 30, 2020

Stock Exchange website: www.msei.in

Company website: www.crescentfinstock.com

Further details are available at:

Date: November 3, 2020

Place: Mumbai

2.85

Place: Mumbai Date: 3" November, 2020

Basic and diluted (Rs. Per share) (not annualised)

Date: 03.11.2020

Place: Rajkot

SUNCARE TRADERS LTD.

CIN: L51909GJ1997PLC031561 SUNCARE Regd. Office: 7, Shree Shakti Estate, Behind Milan Complex, Sarkhej-Sanand Cross Road, Sarkhej, Ahmedabad-382210. Tel: +91-079-2689 1210 Website: www.sctl.in, Email: sctl31561@gmail.com

NOTICE

NOTICE is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the meeting of the Board of Directors of the Company will be held on Tuesday, November 10, 2020 at 01.30 P.M. at the Registered office of the Company at 7, Shree Shakti Estate, Behind Milan Complex, Sarkhej- Sanand Cross Road, Sarkhej, Ahmedabad - 382 210, inter alia, to consider, approve & take on record the Standalone and Consolidated Un-Audited Financial Results of the Company along with the Limited Review Report for the 2nd Quarter ended on September 30, 2020 as per Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. In this connection, as per the Company's Code of Conduct to regulate, monitor and report trading by insiders, adopted by the Board pursuant to SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015, the trading window for dealing in the securities of the Company will be closed for the Specified Persons from Thursday, October 01, 2020 to Thursday, November 12, 2020 (both days Inclusive). The Trading Window will be re-opened from Friday, November 13, 2020 onward.

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, aforesaid notice can be accessed from the Company's Website at www.sctl.in and can also be accessed from the website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com.

and www.nseindia.com.

Place: Ahmedabad

Particulars

2. Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)

Net Profit for the period before Tax (after Exceptional and/ or Extraordinary Items) 4. Net Profit for the period after Tax (after Exceptional and/ or Extraordinary Items)

5. Total Comprehensive Income for the period (Comprising Profit for the

Period (after Tax) and other Comprehensive income (after Tax)

7. Earnings per share (of Rs.10/-each) Basic/ Diluted

of the Company in its meeting held on 03.11.2020.

Date: 03.11.2020

1. Total Income from Operations (net)

6. Equity Share Capital

Place : Ahmedabad

Date: 03-11-2020

For, Suncare Traders Limited Niyant Parikh Date: November 03, 2020 Managing Director Place: Ahmedabad DIN: 02114087

THE SANDESH LIMITED

Registered Office: "Sandesh Bhavan", Lad Society Road,

Phone No.: (079) 40004000 • Fax: (079) 40004242.

B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad-380054 (Gujarat)

Email:- investorsgrievance@sandesh.com • Website:- www.sandesh.com

By order of the Board,

Company Secretary

Dhaval Pandya

For THE SANDESH LIMITED

Ended

Unaudited

0.00

-0.09

-0.09

-0.09

-0.09

500.00

0.00

Six Months Corresponding

Unaudited Unaudited

0.00

-14.15

-14.15

-14.15 -14.15

500.00

30-09-2020 30-09-2020 30.09.2019

0.00

-3.76

-3.76

-3.76

-3.76

500.00

-0.08

GBL INDUSTRIES LIMITED

MANAGING DIRECTOR

Ended 3 Months Ended

CIN - L22121GJ1943PLC000183

NOTICE OF BOARD MEETING NOTICE is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of

SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a meeting of the Board of Directors of the Company will be held on Thursday,

November 12, 2020, at 05:30 p.m., at Registered Office of the Company, inter alia, to

consider, approve and take on record the Standalone and Consolidated Un-Audited Financial Results of the Company for the Quarter and Six months ended on

September 30, 2020. The information contained in this Notice is also available on the

website of the Company i.e. www.sandesh.com and also on the website of the Stock

Exchanges, where the equity shares of the Company are listed i.e. www.bseindia.com

Further, as per the "Code of Conduct for Prevention of Insider Trading" and "Code of

Practices and Procedures for Fair Disclosure of Unpublished Price Sensitive

Information" adopted by the Company under SEBI (Prohibition of Insider Trading)

Regulations, 2015, as amended, the Trading Window for trading in the Equity Shares

of the Company has been closed from October 1, 2020 till the expiry of 48 hours after

the declaration of the Standalone and Consolidated Un-Audited Financial Results for the Quarter and Six months ended on September 30, 2020, to the Stock Exchanges.

GBL INDUSTRIES LIMITED

(Formerly known as GUJARAT BITUMEN LIMITED) . CIN: L24117GJ1985PLC007985

Regd. Off: 801, SAFAL PRELUDE, 8th Floor, B/h. Pinnacle Business Park, Corporate Road, Prahladnagar,

Ahmedabad-380015, E-mail: gujaratbitumen@gmail.com • web : www.gujaratbitumen.com, Tel. : 91-8160162721

Extract of Unaudited Financial Results for the Quarter Ended & Half Ended on 30th Sept., 2020 (Rupees in Lakhs)

Notes: 1. The above is an extract of the detailed format of Financial Results filed with Stock Exchanges under Regulation 33 of SEBI (LODR) Regulations, 2015. The full format of the Financial Results is available on the Stock Exchanges Website (www.bseindia.com) and on Company's website (www.gujaratbitumen.com). The said Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors

KONNDOR INDUSTRIES LIMITED RMERLY KNOWN AS ARMS PAPER LIMITED CIN: L51100GJ1983PLC006041 Regd. Office: 201 Avdhesh House, Nr. Devang Park, Opp. Guru Govind Gurudwara,

0.04

2.83

Email: konndorind@gmail.com, Website: www.konndorindustries.com NOTICE NOTICE is nereby given that pursuant to the provisions of Regulation 29 read with Regulation 47 (1) (a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Meeting of the Board of Directors of the Company will be held on

Wednesday, 11" November, 2020 at the

Registered Office of the Company, inter alia, to

consider, approve and take on record the

Un-audited Financial Results of the Company

for the quarter and half year ended on

S. G. highway, Thaltej, Ahmedabad - 380054

30° September, 2020. By Order of the Board of Directors Place: Ahmedabad Date: 03.11.2020 Company Secretary

Virat Industries Ltd. Regd. Office: A-1/2, GIDC Estate, Kabilpore, Navsari – 396 424, Gujarat.

NOTICE

NOTICE is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Thursday, 12th November, 2020. through Video Conference, to consider and take on record, the Unaudited financial results for the quarter and half year ended 30th September, 2020.

By Order of the Board of Directors For Virat Industries Ltd.

Tony G. Gandhi Mace: Navsari Date: 04-11-2020 Company Secretary

Reed. Office: 88 National Highway, Near Microwave Tower Shapar (Veraval), Dist. Rajkot, Gujarat, INDIA 360024 Ph.: 02827 235500, E-Mail: investorrelations@atulauto.co.ir NOTICE Notice is hereby given pursuant to

provisions of Regulation 47 of the SEBI Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that meeting of Board of Directors of the Company will be held on Saturday November 07, 2020 to consider and approve the unaudited standalone and consolidated financial results for the quarter and half year ended on

Information in this regard is also available on the website of the Company i.e. www.atulauto.co.in and on the website of the stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com. For, ATUL AUTO LIMITED

(Paras J Viramgama)

Place: Shapar (Veraval) Company Secretary & Compliance Officer

Date : 02-11-2020 OLLY PLASTIC INDUSTRIES LIMITED

eptember 30, 2020.

(CIN: L70100GJ1981PLC004932) Regd. Office: 439, Jagriti Enclave, Vikas Marg, Delhi-110092 E-Mail: jollyplasindltd@gmail.com Vebsite: www.jollyplasticindustriesltd.in


NOTICE


Notice is hereby given that Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations 2015, that the meeting of the Board of Directors will be held on Tuesday 10th day of November, 2020 inter alia, to consider and approve the Unaudited Financial Results of the Company for the quarter and half year ended on 30th September, 2020 along with other business if any.

The said notice may be accessed on the Company's website a www.jollyplasticindustriesltd.in and may also be accessed at Stock Exchange Website as www.bseindia.com

For Jolly Plastic Industries Limited

Date: 03.11.2020 Atul Kumar Agarwal Place: Rajkot





C=









ખરીદ/વેચાણ અંગેની જાહેર નોટિસ

કિસ્ટ્રીકટ સુરત, તાલુકો: પુણા(સુરત સીટી)ના મોજે **ગામ સરવાણાનાં** રેવન્થુ સર્વે નંબર ૧૬૦ .60, ૧७૧/૧ પૈકી **બ્લોક નંબર ૧૬૪** જેને લાગુ **ટી.પી. સ્કીમ નંબર ૨૨(સરવાણા-વાલક) ફાઇનલ**

અધિકાર રહિતના મિલકતના માલિક, કબજેદાર તરીકે **રમેશભાઈ કાળુભાઈ વાઘાણી**ની માલિકીને

ચાલી આવેલ છે. તેઓ સદરહું મિલકતના ટાઇટલ ચોખ્ખા અને માકેટેળલ હોવાનું જણાવી અમાર અસીલ શ્રી ઉમેરાભાઇ મનુભાઇ ડોબરીચા રહેવાસી સુરતનાને વેચાણ આપવાનું નકકી કરેલ છે અને બાનાની રકમ પણ ચેકથી સ્વીકારીને અમારા અસીલને સાટાખત પણ કરી આપેલ છે.

સદરહ ਮਿલકਰ ਪਟਰੀ ਤੇ ਰੇਗ ਟਾઇਟਰ ડੀડઝ ਪਟਰੀ ਤੇ ਮਾਰਿਤੀ ਫ਼ੜਤ ਲੱਯੰਬੈ ਤੀઇਗੇ ਤੀਓਪਰ

કારનો વાંધો તકરાર ફોઇ કે કોઇનો કોઇપણ પ્રકારનો ભાગ, લાગ ફક્ક, ફિત, ફિસ્સો, દર દે ાવો ભરણપોષણનો હકકો, લીચન, છાંમેન્ટના હકક, ગણોતના હકક, રસ્તાના હકક હોઇ થા કોઇ

વ્યક્તિ બેંક, સંસ્થાનું કોઇપણ પ્રકારનું લેશું, કરજ, ગીરો કે બોજો હોઇ કે કોઈના કોઇપણ પ્રકારે અગ્ર હક્ક હોઇ કે કોઇના સાટાખતની રૂએ કે કુલમુખત્યારનામાની રૂએના હક્કો હોઇ કે કોઈના વારસારનાં હક્કો હોઈ કે સદ્રસ્હુ મિલકતના્ અમારા્ અસીલ સાથે થૂતાં વેચાયના વ્યવહારો સંબંધે

આથી લાગતા વળગતા તમામ આસામીઓને જાણ કરવાની કે,

હાઈડ્રોલિક વિભાગ સુરત શહેરના મોટા વરાછા-ઉત્રાણ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેવા/ઓછા પ્રેશરથી મળવા અંગેની અગત્થની જાહેરાત

સુરત મહાનગરપાલિકા

सुरतना शहेरीक्नोने सुरत महानगरपालिङा द्वारा अपाती तमाम सेवाओ श्रेष्ठतग ક્ક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હંમેશ કટીબદઘ રહેલ છે. જે અન્વચે સુરત મહાનગરપાલિકાનો હાઇડ્રોલિક વિભાગ, સુરત શહેરમાં સમાવિષ્ટ વિસ્તારમાં નિચત સમય મર્ચાદામાં, પુરતા જથ્થામાં તેમજ ગુણવત્તા સાથે પાણી પુરવઠો પુરો પાડવા કંમેશા પ્રયત્નશીલ રહે છે. **તા.ભપૃષ્પૃર૦૨૦** ના રોજ સુરત શહેરના મોટા વરાછા-ઉત્રાણ વિસ્તારમાં આર.સી.સી. રોડ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ ફોવાથી જુદી-જુદી ઓવરફેડ ટાંકીઓને પાણી પુરવઠો પુરે પાડતી ૫૦૦ મી.મી. વ્યાસની નળીકાને શીફ્ટ કરવાની કામગીરીના ભાગરૂપે AR Mail જંકશન ਪਾੜੇ आवेल ਸੂਟਰ ਸੁફਾਰગਵਪਾਰਿਤਾ ਬੰચਾਰਿਰ શાક ਸਾਡੇਂਟ ਪਾੜੇ ਰੁਘਾ ਪਾਰੀ ਫ਼ਿੰਕ ਐਪਾਟੰਸੈਕਟ ਪਾਣੇ ફયાત ૫૦૦ મીં.મી. વ્યાસની નળીકા સાથે જોડાય કામગીરી ફાથ ધરવામાં આવનાર છે. આર્થ aा.०५/९९/२०२० ना रोल भोटा वराछा-डिश्राधा विस्तारनी रुळळ योलना हेडजनी टांझीओ જેવી કે M-1, M-2, M-3 & M-4 ના નેટવર્ક હેઠળના નીચે જણાવેલ વિસ્તારોમાં પાણી પુરવઠ મળે તેમ નથી. અને તા.૦૬/૧૧/૨૦૨૦ ના રોજ પાણી પુરવઠો અંશતઃ ઓછા પ્રેશરથી મળવાની शक्यवा रहेली छे वेनी पाहेर पनवाओ वेनी नोंध लेवा वथा छपरना असरकर्वा दिवसो पहेल पुरता षथ्यामां षर्रीयात मुष्पना पाणीना षथ्यानो संग्रह करी लेवा तेमष करकसर पूर्वह વપરાશ કરવા વિનંતી કરવામાં આવે છે.

ઓવરહેડ ટાંકીનું નામ/ટાંકીનું સ્થળ	विस्तारोना नाभो		
M-1 (સેન્ટોસા હાઈટસપાસે ઉબાણ)	ઉત્રાણ ગામતળનો વિસ્તાર તેમજ ઉત્રાણ વી.આઇ.પી.સર્કલની આસપાસનો ટી.પી. વિસ્તાર.		
M-2 (સી.એન.જી. પશ્પ પાસે મોટા વરાછા)	મોટા વસછા વોટર ટ્રીટમેન્ટ પ્લન્ટ, વાસ્તુપૂજા હાઈટસથી મહાસજા ફાર્મ, મહાસજા ફાર્મથી સમયોકનો આસપાસનો વિસ્તાર.		
M-3 (મોટા વરાછા ક્લ્રસ્તાન પાસે)	મોટા વરાછા ગામતળ, મોટા વરાછા કબ્રસ્તાનથી અબ્રામાં ચેક પોસ્ટ સુધી તથા મોટા વરાછા કબ્રસ્તાનથી સવજી કોરાટ બ્રીજ સુધીનો સમગ્ર વિસ્તાર તેમજ સદ્દો ચોકથી રામચોક સુધીનો સમગ્ર વિસ્તાર અને પેડર રોડનો સમગ્ર વિસ્તાર.		
M-4 (સવજી કોરાટ બ્રીજ પાસે મોટા વરાછા)	મોટા વરાછા ગામતળ, સેટલાઇટ મેઇન રોડ , મહાદેવ ચોકથી લબામણી ચોકસુધીનો સમગ્ર વિસ્તાર તથા સુઘમાં ચોકથી ચમુના ચોક સુધીનો સમગ્ર વિસ્તાર		


શહેરના ઉપરોક્ત વિસ્તારના નાગરીકોને પડનાર તક્લીફો સબબ દિલગીરી વ્યક્ત કરવામાં આવે છે અને પ્રહાસ આપવા આથી વિનંતી કરવામાં આવે છે

નં.પી. આર.ઓ/૧૪૮૫/૨૦૨૦-૨૧

એડી. સીટી ઇજનેર

<mark>જાહેર નોટીસ</mark> એસ.એમ.રજવાડી, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી/અસ્જદાર : હિમ્મલસિંહ રતનસિંહ ગડરિયા નં. જ. મ. પ્ર/એસ રહે. લોટ નં.દુજ-દૂપ, ચંદ્રલોક સોસાયટી, પસ્વટગામ,સુરત-૩૯૫૦૧૦ તા. ૨૯/૦૯/૨૦૨૦

રહે. 'બ્રોટ નં.દુષ્ઠ-દૂપ, ચંદ્રબીક સોસાયટી, પસ્વટગામ,સુરત-૩૯૫૦૧૦ તા. ૨૯/૦૯/૧૦૨૦ વિરુદ્ધ પ્રતિવાદી/સામાવાળા: જન્મ મરણ રહ્યું સુરત મહેન્નગરપાલિકા, સુરત. વિષ્યુ : જન્મ/મરણની નોંધણી અધિનિયમની કલમ ૧૩(૩) મુજબ જન્મ/મરણની નોંધણી કરાવવા બાબત. આથી આ જોરે નોટીસથી લાગતા-વળગતા તમામ ઈસમોને જણાવવામાં આવે છે. કે, સદર અરજીમાં અરજદારકો હિમ્મતારિક રતાનીરિક અદિયા, રહે. બોટ નં. દુષ્ઠ-દૂપ, ચંદ્રબીક સોસાયટી, પસ્વટ આમ, સુરત-૩૯૫૦૧૦ના માતા ભીખીબેન રતાનીરિક અદિયાનું અવસાન તા. ૦૩/૦૬/૨૦૦૫ ના રોજ પ્રદેશ નં. દુષ્ઠ-દૂપ, ચંદ્રબીક સોસાયટી, પસ્વટગામ, સુરત ખાતે થયેલ છે અને તેઓના અવસાનની નોંધણી જે-તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂંકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંધણી કરાવવા અમેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંધણી કરાવવા સામદાળાને હુકમ કરવા સામે કોઇ પણ ઇસમને વાંધો કે તકરાર હોય તો અમેની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રજૂ કરવો. જો વાંધો નહીં આવે તો વાંધો નથી, તેમ માની આગળની કાર્યવાદી કરવામાં આવશે. જેની તમામ લાગતા-વળગતા ઇસમીએ નોંધ હોતી. આજ રોજ તા. ૧૯/૦૯/૧૦૧૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.



<u>જાહેર નોટીસ</u> એસ એમ રજવાડી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી : ભટ્ટ હીના ભુપેન્દ્રવદન રહે :- ૯૮,મહાવીરનગર સોસાયટી,ન્યુ કોસાડ રોડ,અમરોલ-૩, સુરત નં.જ.મ.પ./એસ.આર.નં. ૩૧૧/૨૦૨૦ dl. 05/06/5050

સાલાવદા, જુ કાલાંક રાકું અમારા કું કુંદર વિરૂદ્ધ પ્રતિવાદી : (૧) જન્મ મરણ રજીસ્ટ્રારમી સુરત મહાનગર પાલિકા, સુરત વિષય : જન્મ/મરણની નોંધણી અધિનિયમની કલમ-૧૩ (૩) મુજબ જન્મ/મરણની નોંધણી કરાવવા બાબત

આથી આ જાહેર નોટીસથી લાગતા વળગતા તમામ ઈસમોને જણાવવામાં આવે છે કે, સદર આવા આ પાઉર નાદાસાથી લાગતા વર્ણમાં તમામ કરતાના વર્ણાવનાના અંધ છ , ઘર અરજીમાં અરજદારશ્રી ભટ્ટ હીના ભુપેન્દ્રવદન રહે :- હદ, મહાવીરનગર સોસાચટી,ન્યુ કોસાદ રોડ,અમરોલી-3, સુરતના માતા સુનિતાબેન ભુપેન્દ્રવદન ભટ્ટનું અવસાન તા.૧૮/૦૯/૧૯૮૬ ના રોજ પ્રિયા એપાર્ટમેન્ટ, નાનપુરા, સીવીલ કોર્ટની સામે, સુરત ખાતે થયેલ છે અને તેઓના અવસાનની નોંઘણી જે તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંઘણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઈપણ ઈસમને વાંદો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-30 માં વાંદો રજુ કરવો. જો વાંદો નહીં આવે તો વાંદો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની

આજ રોજ તા. ૦૮/૦૯/૨૦૨૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરીને આપ્યો. હકમથી :- સહી (એસ.એમ.રજવાડી) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાયબ કલેક્ટર સીટી પ્રાંત, સુરત

જાહેર નોટીસ એસ એમ રજવાડી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી : સેયદઅલી મોહંમદઅલી સેયદ, રહે :- પ્લોટ નં.૧૧, નં.૧.મ.૫./એસ.આર.ને. ૩७૦/૨૦૨૦ બુધ્ધ સોસાયટી,મયુર સીનેમા પાસે,ઉદ્યનાથાર્ડ,ઉદ્યના,સુરત તા.૧૪/૧૦/૨૦૨૦

વિરક્ધ

પ્રતિવાદી : (૧) જન્મ મરણ રજીસ્ટ્રાસ્ત્રી સુરત મહાનગર પાલિકા, સુરત વિષય : જન્મ/મરણની નોંઘણી અધિનિયમની કલમ-૧૩ (૩) મુજબ જન્મ/મરણની નોંઘણી કરાવવા બાબત આથી આ જહેર નોટીસથી લાગતા વળગતા તમામ ઈસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરજદારશ્રી સૈંચદઅલી મોહંમદઅલી સૈંચદ, રહે :– પ્લોટ નં.૧૧, લુધ્ધ સોસાયટી,મયુર સીનેમા પાસે, ઉદ્યનાચાર્ડ, ઉદ્યના, સુરતના અરજદાર પોતે સૈંચદઅલી મોહંમદઅલી સૈંચદનો જન્મ તા.૦૧/૦૬/૧૯૭૦ ના રોજ લાલદરવાજા, કીલ્લાની વાડી, સુરત ખાતે થયેલ છે અને તેઓના જન્મની નોંઘણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર જન્મની નોંઘણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઈપણ ઈસમને વાંધો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રજુ કરવો. જો વાંધો નહી આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્ચવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા

આજ રોજ તા. ૧૪/૧૦/૨૦૨૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરીને આપ્યો. હુકમથી :– સહી (એસ.એમ.૨જવાડી) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાયબ કલેક્ટર સીટી પ્રાંત, સુરત

જાહેર નોટીસ એસ.એમ.૨જવાડી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી : જરીવાલા ધનસુખભાઇ મણિલાલ, રહે :- ફ્લેટ બી નંજ.મ.પ્ર./એસ.આર.નં. ૩૯૪/૨૦૨૦ વાદ : જરાવાના ઘનલુખાના નાહાનાન, દહ વ ૧,૪૦૨, સીલ્વર રેસીકેન્શી, સગરામપુરા, સુરત વિરૂદ્ધ પ્રતિવાદી : (૧) જન્મ મરણ રજીસ્ટ્રાસ્ત્રી સુરત મહાનગર પાલિકા, સુરત વિષય : જન્મ/મરણની નોંઘણી અધિનિયમની ક્લમ-૧૩ (૩) મુજબ જન્મ/મરણની નોંઘણી કરાવવા બાબત

આથી આ જાહેર નોટીસથી લાગતા વળગતા તમામ ઈસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરજદારથી જરીવાલા દાનસુખભાઇ મણિલાલ, રહે :- ફલેટ બી-૧,૪૦૨, સીલ્વર રેસીડેન્સી, સગરામપુરા, સુરતના માતા રમણબેન મણીલાલ રાણા (જરીવાલા)નું અવસાન તા.૦૨/૦૯/૨૦૦૫ ના રોજ ૯૬, પુષ્પાનગર, ઉદ્યના, સુરત ખાતે થયેલ છે અને તેઓના અવસાનની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંઘણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઇપણ ઈસમને વાંધો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રજુ કરવો. જો વાંધો નહી આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્ચવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા

આજ રોજ તા. ૨૩/૧૦/૨૦૨૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો. હકમથી :- સહી (એસ.એમ.રજવાડી) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાચબ કલેક્ટર સીટી પ્રાંત, સુરત

જાહેર નોટીસ એસ એમ રજવાડી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી : મેહરાઝબીબી અબ્દુલસમદ મન્યુરી તે ગુલામ હુશેનની નં.જ.મ.પ્ર./એસ.આર.નં. ૪૦૦/૨૦૨૦ પુત્રી, રહે :– પ/૧૮૬૮,તળાવ મહોલ્લો,સૈચદપુરા, સુરત તા. ૨૩/૧૦/૨૦૨૦ વિરૂદ્ધ પ્રતિવાદી : (૧) જન્મ મરણ રજીસ્ટ્રાસ્ત્રી સુરત મહાનગર પાલિકા, સુરત વિષય : જન્મ/મરણની નોંઘણી અહિનિયમની ક્લમ-૧૩ (૩) મુજબ જન્મ/મરણની નોંઘણી કરાવવા બાબત

આથી આ જાહેર નોટીસથી લાગતા વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરજદારથ્રી મેહરાઝબીબી અબ્દુલસમદ મન્સુરી તે ગુલામ હુશેનની પુત્રી, રહે :-૫/૧૮૬૮,તળાવ મહોલ્લો,સૈયદપુરા, સુરતના માતા અમીનાબીબી ગુલામ હુશેન મન્સુરીનું અવસાન્ તા.૦૪/૧૦/૨૦૦७ ના રોજ ૪/૩૦૧૩, અહમદ નસીર સ્ટ્રીટ, તાડવાડી મરજીદસામે,બેગમપુરા, સુરત ખાતે થયેલ છે અને તેઓના અવસાનની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંઘણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઈપણ ઈસમને વાંઘો કે તકરાર હોય તો અત્રेની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રજુ કરવો. જો વાંધો નહી આવે તો વાંધો નથી

આજ રોજ તા. ૨૩/૧૦/૨૦૨૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો. (એસ.એમ.રજવાડી) અલ દીવાપ્ય કેર્યો :- સહી તેમ માની આગળની કાર્ચવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા-વળગતા ઈસમોએ નોંઘ લેવી. (એસ.એમ.२९पाडी) सल डीपीजनल मेजुस्ट्रेंट, અने नायल इलेइटर सीटी प्रांत, सुरत

<mark>જાહેર નોટીસ</mark> એસ.એમ.રજવાડી, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં याही/अरुष्टारः आक्षाशलाधं पिरन गुवाले रहे. २४७, सांधनगर, डोंडोली, ताबुङो, धंधना, षिदलो सुरत.

હિરુદ્ધ પ્રતિવાદી/સામાવાળા: જન્મ મરણ રજીરદ્રાસ્ત્રી, સુરત મહેનાગરપાલિકા, સુરત વિષય: જન્મ/મરણની નોંધણી અધિનિયમની કલમ ૧૩(૩) મુજબ જન્મ/મરણની નોંધણી કરાવવા બાબત. આથી આ જાહેર નોરીસથી લાગતા-વળગતા તમામ ધરામોને જણાવવામાં આવે છે કે, સદર અરભુમાં અરજદાસ્ત્રી આક્લાભાઇ પિરન ગુલાલે, રહેઃ-૧૪૭,સાંઇનગર,ડોંડોલી,તાલુકો : ઉંઘના, જિલ્લી સુરતના માતા હાસરબાઇ પિરન ગુલાલેનું અવસાન તા.27/08/2007 ના રોજ ૪૯, આવિભીવ સોસાયટી-ર, પાંડેસર, સુરત ખાતે થયેલ છે. અને તેઓના અવસાનની નોંધણી જે-તે વખતે કરાઘદાથી અજાણ હોઇ ભૂલ ર, પાકસરા, સુરત ખાત થયલ છે. અને તઓનો અવસાનનો નાધણા જ-ત વખત કાયદાથા અજાણ છો ખુલ અને શરતશૂંકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંધણી કરાવવા અંગેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંધણી કરાવવા સામધાળાને હુકમ કરવા સામે કોઈ પણ દીસમને વાંદી કે તકરા હોય તો અંગ્રેની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-30 માં વાંધો રજૂ કરવો. જો વાંધો નહી આવે તો વાંધો નથી, તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતાં-વળતાં હયમોએ નોંધ લેવી. આજ રોજ તા. ૧૯/૧૦/૧૦૧૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો. કુકમથી (એસ.એમ.રજવાડી)



नायज इसेइटर, सीटी प्रांत, सुरत. પંથ ઈન્ફીનીટી લીમીટેડ

Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com આથી નોટીસ આપવામાં આવે છે કે સેબી(લીસ્ટીંગ ઓબ્લીંગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમેન્ટ્સ) આવા માટાત આવામાં આવે છે કે દાળા(લાસ્ટાગ આપ્લાગણને અન્દ દિવાગ નાહિના માટે મુખ્ય કરિકાવાન રાકદાવાનું મહત્વો ભાગ નિયમન ૨૦૧૫ ની કલમ ૪૯(૧)(અ) અને ૨૯(૧)(અ) મુજબ કંપની પશ્ચ **ઇન્ફિનીટ (નીમેટ**ના બોર્ડ એક્ટિક્ટર્સ ની મિટીંગ નં. ૫/૨૦૨૦-૨૧ સોમવાર, તા.૧૧ નોઅંગર, ૨૦૨૦ ના રોજ બપોર્ટ ૨.૦૦ કલાકે. કંપનીની રસુસ્ટર્ડ ઓફિસ, ૧૦૧, રિક્દા શેખર્સ, તરિતેયા હુનુમાંન શેરી, ગુર્જર ફળિયા, હરિપુરા, સ્ટ્રાટલ-૩૮૫૦૦૩ ગુજરાત, ભારત ખાતે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ સમાત્વ થયેલ ત્રીમાસીક અને વાર્વિક સમયગાળાના બિન્સનોનોપ્રોમ મળ્યો

રજી. ઓફિસઃ ૧૦૧, સિધ્ધ ચેમ્બર્સ, તરતીયા હનુમાન શેરી, ગુર્જર ફળીયા, હરીપુરા, સુરત-૩૯૫૦૦૩, ગુજરાત.

આ નોટીસ કંપનીની વેબસાઈટ www.panthinfinity.com અને સ્ટોક એક્સરોન્જ ની વેબસાઈટ www.bseindia.com અને www.cse-india.com પર ઉપલબ્દ છે.

સ્થળઃ સુરત

પંથ ઈન્ફિનીટી લીમીટેડ વતી श्वनय कीरडीया येरमेन એन्ड मेनेश्वंग डायरेक्टर DIN: 03362317

કોઇને કોઇપણ પ્રકારનો વાંધો કે તકરાર ઢોઇ તો તેઓએ આ નોટિસ પ્રસિધ્ધ થયાની તારીખર્થ **દિયસ-હ(સાત)**ની અંદર નીચે લખ્યા સરનામે અમોને લેખિત આધાર પુરાવા સહિત જણાવવું, મુદ્દ વિત્યેથી સદરહું ઉપરોક્ત મિલકત ખરીદ કરવા અંગેની આગળની કોંચદેસરની કાર્યવાહી અમાર અસીલ કરશે અને તે બાદ કોઇના વાંધા તકરાર હશે તો તેવા તમામ વાંધા તકરાર જતાં(WAIVE થયા ગણાશે અને તે અમારા અસીલને શ્રુદ્ધબૃદ્ધિના ખરીદનાર તરીકે બંધનકર્તા થશે નહી. જેને ાથી લાગતા વળગતા તમામ આસામીઓએ સ્પષ્ટ નોંધ લેવી. મારી મારફતઃ હિતેશ બી. દેબરીચા(એક્વોકેટ) ઉમેશભાઈ મનુભાઇ કોબરીયા રહેવાસી સુરતના ઓફિસઃ- ૪૦૦૫, સેન્ટ્રલ બાઝાર, વરાછા પોલીસ સ્ટેશનન સામે, વરાછા રોડ, સુરત-૩૯૫૦૦૬-મો.૯૯૨૬૦૮૦૦૩૫ જાહેર નોટીસ

આથી લાગતા-વળગતા તમામ વ્યક્તિઓને હાલની આ જાહેર નોટીસર્થ જણાવવાનું કે, અમારા અસીલ શ્રી પ્રકાશભાઈ ભાભાભાઈ મિસ્ત્રી, રહેવાસી ઉત્તમ પાર્ક સોસાયટી, નવસારીનાઓની સૂચના અને ફરમાઈશ અન્વયે તેઓશ્રી જી. નવસારીના મોજે ચોવીસી ગામે ખાતા નં. દ્રપટ ૮-અ માં જણાવેલી ચોવીસી ગામે ખાતા નં. દ્રપટ બ્લોક/સર્વે નંબર તથા (હિસ્સા ૪૫૨ ક્ષેત્રફળ હે.આરે. ચો.મી. ૦-૪૦-૩૮ આકાર જુડી બી.એ.વિઉ ૧૨૦.૦૦ બિનખેતીની છે. ૧ મિલ્કતમાં વિનય પાર્ક હાઉસિંગ એસોસીયેશન નવસારી ચાવીસી નામ ફાળવેલ છે. જે સોસાચટીનો રજી. નં. G-૪૮૨૪ છે. જે તા. ૨૬/૦૩/૧૯૯૦ માં નોંધાચેલ છે જે સોસાયટીમાં આવેલ અનુક્રમ નં. ૧૩૨૦, મિલ્કત નં. ૧૨૬૪, મિલ્કત વર્ણન eq जी मिस्डतनो शेर सर्टिड्रिडेट जं. १९ अने शेर जं. eq थी eu वाणी मिसडत ખરીદ કરવા ઈચ્છા ઘરાવે છે. તો એ બાબતે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારને વાંદો વિરોધ હોય તો કાયદેસરના પુરાવા સહિત દિન-૦૦ માં અમોને રૂબરૂ મળવ विनंती छे. मुहत वित्ये डोर्डपण ह्वीव सांत्मणवामां आवशे नहीं. मुहत वित्ये કોઈપણ જાતની તર-તકરાર ચાલશે નહીં. જેની ખાસ નોંધ લેવી.

मधारा मसीवनी सुचनाथी (मेडवोडेर) **मेहुल वी. क्रोटवाणी** ૦૫/૨૦૬, નીલમ એપાર્ટમેન્ટ, સિંધી કેમ્પ, લુન્સીકુઇ રોક, તા.જિ. નવસારી મો.૯૦૩૩૯૯૩૯૦

<mark>જાહેર નોટીસ</mark> એસ એમ રજવાડી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં ભીખુભાઈ છોટુભાઈ ખલાસી, રહે :- ૧૬, નં.જ.મ.પ્ર./એસ.આર.નં. ૩૬૬/૨૦૨૦ વાદા : ભાગુના સ્કુલ ફળીયુ, બુડીયા, સુરત વિરૂદ્ધ 0505/06/8811

પ્રતિવાદી : (૧) જન્મ મરણ રજીસ્ટ્રારશ્રી સુરત મહાનગર પાલિકા, સુરત વિષય : જન્મ/મરણની નોંઘણી અધિનિયમની કલમ-૧૩ (૩) મુજબ જન્મ/મરણની નોંઘણી કરાવવા બાબત આથી આ જાહેર નોટીસથી લાગતા વળગતા તમામ ઈસમોને જણાવવામાં આવે છે કે, સદર આથા આ જાહર નાટાસથા લાગતા વળગતા તમામ ઇસમાન જણાવવામાં આવે છે કે, સંદર અરજીમાં અરજદારથી ભીખુભાઈ છોટુભાઈ ખલાસી, રહે :- ૧૬, સ્કુલ ફળીચુ, બુડીચા, સુરતના પિતા છોટુભાઈ નાચુંબાઈ ખલાસીનું અવસાન તા.૧૪/૦૦/૧૯૯૦ ના રોજ ૧૬, સ્કુલ ફળીચુ, બુડીચા, સુરતા ખાતે થયેલ છે અને તેઓના અવસાનની નોંઘણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંઘણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઈપણ ઈસમને વાંઘો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ માં વાંઘો રજુ કરવો. જો વાંઘો નહીં આવે તો વાંઘો નથી તેમ માની આગળની કાર્ચવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા-વળગતા ઇસમોએ નોંઘ લેવી. આજ રોજ તા. ૧૩/૧૦/૨૦૨૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરીને આપ્યો.

હુકમથી :- સહી (એસ.એમ.૨જવાડી) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાયબ કલેક્ટર સીટી પ્રાંત, સુરત

જાહેર નોટીસ એસ એમ રજવાડી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી : રાજુભાઇ નાનુભાઇ રાઠોડ, રહે :- ૧૦૬, નં.જ.મ.પ્ર./એસ.આર.નં. ૩૭૨/૨૦૨૦ દમણ કળીયુ, હળપતિવાસ, ઉમરા, સુરત તા. ૧૪/૧૦/૨૦૨૦ વિરૂદદ્દ પતિવાદી : (૧) જન્મ મરણ રજીસ્ટ્રારથી સુરત મહાનગર પાલિકા, સુરત વિષ્ય : જન્મ/મરણની નોંઘણી અધિનિયમની કલમ-૧૩ (૩) મુજબ જન્મ/મરણની નોંઘણી કરાવવા બાબત

આથી આ જાહેર નોટીસથી લાગતા વળગતા તમામ ઈસમોને જણાવવામાં આવે છે કે, સદર અરાઇ માં વિશ્વ ભારતિયા લાંગતા વેઇગતા તમામ હતાના વેદાવવાના ભાવ છે કે, સ્ટર્ટ અરજીમાં અરજદારશ્રી રાજુભાઇ નાનુભાઇ રાઠોડ, રહે :- ૧૦૬, દમણ કળીચુ, હળપતિવાસ, ઉંમરા, સુરતના પિતા નાનુભાઇ મંગાભાઇ રાઠોડનું અવસાન તા-૧૯/૦૬/૨૦૧૧ ના રોજ ૧૦૬, દમણ ફળીચુ, હળપતિવાસ, ઉંમરા, સુરત ખાતે થયેલ છે અને તેઓના અવસાનની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંધણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંધણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઇપણ સિમને વાંઘો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન–૩૦ માં વાંઘો રજુ કરવો. જો વાંધો નહી આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્ચવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા-

આજ રોજ તા. ૧૪/૧૦/૨૦૨૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો. લુકમથી :- સહી (એસ.એમ.રજવાડી) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાયબ કલેકટર સીટી પ્રાંત, સુરત

જા<u>લેર નોટીસ</u> એસ.એમ.રજવાડી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી : ભટ્ટ હીના ભુપેન્દ્રવદન રહે :- ૭૮,મહાવીરનગર નં.જ.મ.પ્ર./એસ.આર.નં. ૩૯૫/૨૦૨૦ સોસાયટી,ન્યુ કોસાડ રોડ,અમરોલી-3, સુરત dl. 53/40/5050

સારાવદા,જુ કારા કરા, બારાવાન્ય, યુક્ય વિરૂદ્ધ પ્રતિવાદી : (૧) જન્મ મરણ રજીસ્ટ્રારથી સુરત મહાનગર પાલિકા, સુરત વિષય : જન્મ/મરણની નોંઘણી અધિનિયમની કલમ-૧૩ (૩) મુજબ જન્મ/મરણની નોંઘણી કરાવવા બાબત આથી આ જાહેર નોટીસથી લાગતા વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરજદારશ્રી ભટ્ટ હીના ભુપેન્દ્રવાદન રહે :- હ૮, મહાવીરનગર સોસાયટી,ન્યુ કોસાડ રોડ,અમરોલી-3, સુરતના પિતા ભુપેન્દ્રવાદન નર્મદાશંકર ભટ્ટનું અવસાન તા.૦૯/૦૮/૨૦૦૬ ના રોજ હ૮, મહાવીરનગર સોસાયટી,ન્યુ કોસાડ રોડ,અમરોલી-3, સુરત ખાતે થયેલ છે અને તેઓના અવસાનની નોંઘણી જે તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંઘણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઈપણ ઈસમને વાંઘો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોદીસ પ્રસિઘ્દ થયેથી દિન-૩૦ માં વાંઘો રજુ કરવો. જો વાંઘો નહી આવે તો વાંઘો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા–વળગતા ઈસમોએ નોંઘ લેવી.

આજ રોજ તા. ૨૩/૧૦/૨૦૨૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરીને આપ્યો. હુકમથી :- સહી (એસ.એમ.૨જવાડી) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાયબ કલેક્ટર સીદી પ્રાંત, સુરત

જાહેર નોટીસ એસ એમ રજવાડી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી : ઘંટીવાલા પ્રવીણચંદ્ર ચીમનલાલ, રહે :- 3/ર૩૨૫, નં.જ.મ.પ્ર./એસ.આર.નં. ૪૦૩/૨૦૨૦ વાદા : ઘટાવાડા) ખાંગકશેરી, સલાબતપુરા, સુરત વિરૂદ્ધ di 53/40/5050

પ્રતિવાદી : (૧) જન્મ મરણ રજીસ્ટ્રારશ્રી સુરત મહાનગર પાલિકા, સુરત વિષય : જન્મ/મરણની નોંધણી અધિનિયમની કલમ-૧૩ (૩) મુજબ જન્મ/મરણની નોંધણી કરાવવા બાબત આથી આ જાહેર નોટીસથી લાગતા વળગતા તમામ ઈસમોને જણાવવામાં આવે છે કે, સદર ઝરજીમાં અરજદારશ્રી દાંટીવાલા પ્રવીણચંદ્ર ચીમનલાલ, રહે :– 3/૨૩૨૫, ખાંગડશેરી, સલાળતપુરા, સુરતના માતા રેવાબેન ચીમનલાલ ઘંટીવાલાનું અવસાન તા.૦૧/૦૦/૨૦૦૧ ના રોજ 3/૨૩૨૫, ખાંગડશેરી, સલાબતપુરા, સુરત ખાતે થયેલ છે અને તેઓના અવસાનની નોંઘણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અત્રેની કોર્ટમાં ઝજાણ હાઇ ખુલ અને તરદાસૂક્યાં કદાવવામાં દેશ નાયરા ઝરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંધણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઈપણ જ્ઞિમને વાંધો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રજુ કરવો. જો વાંધો નહી આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્ચવાહી કરવામાં આવશે. જેની તમામ લાગત

વળગતા ઈસમોએ નોંઘ લેવી.

<mark>જાહેર નોટીસ</mark> એસ.એમ.રજવાડી, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં

પ્રતિવાદી/સામાવાળાઃ જન્મ મરણ રજીસ્ટ્રાસ્ક્રી, સુરત મિલાગરપાલિકા, સુરત વિષય ઃ જન્મ/મરણની નોંધણી અધિનિયમની કલમ ૧૩(૩) મુજબ જન્મ/મરણની નોંધણી કરાવવા બાબત. આથી આ જાહેર નોટીસથી લાગતા-વળગતા તમામ ઇસમીને જણાવવામાં આવે છે કે, સદઃ



જાહેર નોટીસ એસ.એમ.રજવાડી, સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી : ચૌઘરી નરેશભાઈ નવીનભાઈ

પ્રતિવાદી : જન્મ મરણ રજીસ્ટ્રારશ્રી : સુરત મહાનગર પાલિકા, સુરત વિષય : જન્મ/મરણ નોંઘણી અધિનિયમની કલમ-૧૩(૩)મુજબ જન્મ/મરણની નોંઘણી કરાવવા બાબત આથી આ જાહેર નોટીસથી લાગતા–વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરજદારશ્રી ચૌધરી નરેશભાઇ નવીનભાઇ, રહે.: હળપતિવાસ, પીપલોદ, સુરતના દાદી રાધાબેન રામુભાઇ ચૌધરીનું અવસાન તા.૨૩/૧૨/૨૦૦૬ ના રોજ ચૌધરીવાસ, તાડવાડી, વરીચાવ, સુરત ખાતે ચચેલ છે. અને તેઓના અવસાનની નોંઘણી જે-તે વખતે કાયદાથી અજાણ હોઈ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંઘણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઈ પણ ઈસમને વાંદો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન–૩૦ માં વાંદો ૨જુ કરવો. જો વાંદો નહી આવે તો વાંદો નથી, તેમ માની આગળની

નાજ રોજ તા.૨૯/૧૦/૨૦૨૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર, સીટી પ્રાંત, સુરત

શ્રી ચલથાણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., મુ.પો.ચલથાણ, તા.પલસાણા, જિ.સુરત-૩૯૪ ૩૦૫

्राष्ट्रशत आडिंशन 📉

સ્મીર્મર હોસ્પિટલ ખાતેથી મળતી

આવેલ આશીર્વાદ ટાઉનશિપની પાછળ

રામનગર સોસાયટીમાં રહેતા ૪૫

વર્ષીય નીતિન નલીનભાઈ જોશી (મુળ

રહે, સાવરકુંડલા, જી.અમરેલી) એ ગત

રાત્રે લોખંડના હુક સાથે દોરી બાંધી ગળે

ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ નીતિન જોશી

કાપડની મીલમાં પ્રિન્ટિંગ મશીન રીપેરીંગ

અને સ્પેરપાર્ટસ વેચાણનું કામ કરીને

પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

બે વર્ષ અંગાઉ તેમને કડોદરા વિસ્તારમાં

અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેમને

જમણા પગ અને આંખમાં ઈજા થઈ

હતી. જેઓ બે વર્ષથી બેકારીનો ભોગ બન્યા હતા. બીજીતરફ પત્ની ખાનગી

કંપનીમાં કામ કરી પરિવારને મદદરૂપ

થતી હતી. નીતિન જોશી પણ અવાર-

નવાર કામ-ધંધો શોધવા બહાર પણ જતા

હતા. પરંતુ અપંગ જેવી પરિસ્થિતિના કારણે કામ કે નોકરી મળતી ન હતી.

અંતે કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. તેમને સંતાનમાં એક પુત્ર છે.

સચિનમાં ઘરકંકાસથી

કંટાળી મધ્યપ્રદેશની

પરિણીતાનો આપઘાત

આવેલ કાપડના કારખાનામાં રહેતી ૨૬

વર્ષીય પ્રિયકાબેન હીરામણીભાઈ તિવારી

ગઇકાલે બપોરથી સાંજ દરમિયાન

રૂમમાં પંખાના હૂક સાથે દુપક્રો બાંધી

ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે પ્રિયંકાબેન

મુળ મધ્યપ્રદેશના શિરીવાનીના વતની

હતા. તેણીએ ઘર કંકાસથી કંટાળી

જઇને અંતિમ પગલં ભર્ય હોવાની શંકા

સેવવામાં આવી રહી છે. બનાવના

પગલે તેણીના બે સંતાનોએ માતાની

છત્રછાયા ગુમાવી દીધી છે. તેમના

પતિ કાપડના કારખાનામાં કામ કરે છે.

આ અંગે સચીન જીઆઇડીસી પોલીસે

અમરોલીઃ હળપતિવાસના મકાનમાં ગેસનો બાટલ

લીકેજ થતાં આગ ભભકી

અમરોલી

હળપતિવાસના એક મકાનમાં આજે

સવારે 11 વાગ્યના સુમારે રસોઇ બનાવતી

વખતે ગેસ સિલિન્ડર લિકેજ થતા આગ

ફાટી નિકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ

ધારણ કરી લેતા ઘર વખરીનો સામાન

બળીને ખાખ થઇ ગયો હતો. ઘરના

સભ્યો સમય સુચકતા વાપરી ઘરની બહાર

નિકળી જતા કોઇને ઇજા કે કોઇ જાનહાનિ થઇ નહોતી. ફાયર બ્રિગેડને કોલ મળતા

અમરોલી ફાયર સ્ટેશનના લાશ્કરો સ્થળ

પર દોડી ગયા હતા અને સતત પાણીનો

મારો ચલાવી આગ ઓલવી કાઢી હતી.

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય આગમાં ઘર વખરીનો સામાન બળી જતા ભારે નુકશાની થઇ હોવાનું સુત્રો

જોબવર્ક કરાવી સાડા ત્રણ

્કરોડનું ઉઠમણું કર્નાર વેપારી

વિજય રાજના જામીન ફગાવાયા

અભિર્ષેક રેસીડેન્સીમાં રહેતા રાજેશ

મોહનલાલ અગ્રવાલ પ્રાઇમ પ્લાઝા

ટેક્સટાઇલ માર્કેટમાં રિધ્ધિ સિધ્ધ

ફેબ્રીક્સના નામથી વેપાર કરતા હતા. દરમિયાન તેઓ વેસુ શગુન રેસીડેન્સીમાં

રહેતા કૈલાસ વિજયરાજ ભાદાણી, તેમના

પત્ની સોનુબેન , બિજયરાજ બાલચંદ

ભાદાણી અને કાપડ દલાલ અનિલ

દુર્ગાદત્ત શર્માના પરિચયમાં આવ્યા

હતા. કાપડ દલાલ તેમજ વેપારીઓએ

મળીને રાજેશ અગ્રવાલ પાસેથી સાડા

ત્રણ કરોડની કિંમતનું જોબવર્ક કરાવી

તેનું પેમેન્ટ નહીં કરી ઉઠમણુ કર્યું હતું.

આ મામલે સલાબતપુરા પોલીસ મથકે

ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ પકડથી

બચવા આરોપી બિજયરાજ બાલચંદ

ભાદાણીએ આગોતરા જામીન અરજી

કરી હતી. અરજી કોર્ટમાં ચાલી જતા

સરકારી વકીલ કિશોર રેવલીયાએ

દલીલો કરીને આરોપીના જામીન

નામંજૂર થવા કોર્ટને અરજ કરી હતી.

કોર્ટ બંને પક્ષોની દલીલો બાદ આરોપી બિજયરાજના આગોતરા જામીન

મહેશ્વરી લોજીસ્ટીક્સ લિમિટેડ

રછુસ્ટર્ડ ઓફિસઃ એમએલએલ હાઉસ ,શેડ

નં એ.૨-૩/૨ યુપીએલ , ની સામે ફર્સ્ટ ફેઝ છુઆઇડી સી ,વાપી વલસાડ છુજે-396195

♦ोव:0260-2431024 ,

ध-भेदः info@ mlp1.biz/cs@ mlp1.biz बोटीस

आथी तेजीना टेञ्युतेशन २६ अने

લિસ્ટિંગ ઓળ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર

નામંજૂર કર્યા હતા.

સુરતઃ પર્વત પાટીયા વિસ્તારમાં

પાસેથી જાણવા મળે છે

તપાસ હાથ ધરી છે.

સુરતઃ સચિન જીઆઈડીસીમાં

શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.,

ચલથાણની મતદાર ચાદીની મતદાર ચાદીની પ્રસિદધ અંગેની જાહેરાત ગુજરાત સરકારશ્રીએ ખાંડ સહકારી મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી મુકત કરી પ્રાથમિક મંડળીમાં ગુજરાત એકટ નંબર-૧૩ ઓફ ૨૦૧૯ તા.૦૩-૦૮-૨૦૧૯ તેમજ નોટીફિકેશન નંબર GHKH-91GCS-10-2019-256/છ તા.૦૫-૦૯-૨૦૧૯ થી સુધારા અધિનિયમ અમલમાં આવેલ છે. તેમજ ખાંડ નિયામકશ્રી ગુજરાત રાજયનાં હુકમ ક્રમાંક:સરમ/૦૧/ઝ-૧/૨૧૬/૨૦૨૦ તા.૧૯-૦૨-૨૦૨૦ તથા કૃષિ ખેડૂત કત્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક:જીસીએસ/૬૨/૨૦૨૦ જીસીએસ/૧૦/૧૧૫/છ., તા ૩૦-૦૬-૨૦૨૦, કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, સુરતની કરોરીનાં પત્ર ક્રમાંક નં એમયુએન/ચ.વિ.ખાં.ઉ.મં./વશી./૨૦૨૦, તા.૨૨-૧૦-૨૦૨૦ મુજબ હું શ્રી મનહરભાઇ લલ્લુભાઇ પટેલ ચૂંટણી અધિકારી શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી, ચલંચાણ આથી જાહેર કરે છું કે પલસાણા તાલુકાની શ્રી ચલંચાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ચલથાણની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી થવાની છે અને આ સાથેની અનુસુચિના કોલમ નં.૧ માં નિર્દિષ્ટ કરેલ મતદાર મેંડળ અથવા મતદાર મેંડળો (જેંનો આમા હવે પછી ''સંબંધીત મતદાર મેંડળ'' તરીકે ઉલ્લેખ કર્યો છે.) તેની ચૂંટણીના સબંધમાં છેવટની મતદાર યાદીઓ (આખરી મતદાર યાદીઓ) તા ૦૬-૧૧-૨૦૨૦ ના રોજ સંસ્થાનાં નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે અને ત્યાર પછી ચુંટણીનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે.

મતદાર ચાદી પ્રસિદિધ અંગેની જાહેરાત

અ .નં.	વિગતો	તારીખ	સમય	₹an
٩.	મતદારયાદી પ્રસિધ્ધિ	08-99-5050	૧૧-૦૦ ક્લાકે	શ્રી ચલથાણ વિ.ખાં.ઉ.સ.મં.લી. ચલથાણની ઓફિસે
૨.	મતદાર યાદી સામે વાંદો હોય તો તે રજુ કરવાની છેલ્લી તારીખ અને સ્થળ	૦૫-૧૧-૨૦૨૦ શ્રી ૦૬-૧૧-૨૦૨૦	૧૫-૦૦ ક્લાકે સુધી	શ્રી ચલથાણ વિ.ખાં.ઉ.સ.મં.લી. ચલથાણની ઓફ્સિ
3.	वांधा अंगे सुनावणी अने निर्णय	08-44-5050	૧૫-૦૦ ક્લાકે પછી	શ્રી ચલથાણ વિ.ખાં.ઉ.સ.મં.લી. ચલથાણની ઓફ્સિ
٧.	આખરી મતદાર યાદી પ્રસિધ્ધ	08-44-5050	અ.નં.૩ની કામગીરી પૂર્ણ થયા બાદ	શ્રી ચલથાણ વિ.ખાં.ઉ.સ.મં.લી. ચલથાણની ઓફિસે

dl. 03/99/2020 यसयाध-उद्धर उ०५

(મનહર એલ પટેલ) ચૂંટણી અધિકારી શ્રી ચલચાણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.,

(यंरणी सज इभिटिना आहेशथी)

શ્રી ચલથાણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., મુ.પો.ચલથાણ, તા.પલસાણા, જી.સુરતની ચુંટણી-૨૦૨૦

-: ચૂંટણી અંગેનું જાહેરનામું :-નમુનો-૧ (જુઓ નિયમ-૧૬)

ગુજરાત राજય सहङारी मंडणीओनी समितिनी यूंटणी नियमो अने संरथाना पेटा नियम तथा यूंटणी ઉप-नियमो मुक्क अने व्यवस्थापङ ङमिटिએ निमेल यूंटणी ङमिटिએ आपेल सत्तानी इसे हुं श्री मनहरक्षार्घ सेल. पटेल आथी જાહેર કરૂ છુ કે, શ્રી ચલથાણ વિભાગ ખાંડે ઉદ્યોગ સહકારી મંડળી. લી., ચલથાણ તા.પલસાણા, જિ.સુરતના નામે ઓળખાતી સહકારી સંસ્થાનાં વ્યવસ્થાપક સમિતિના ઉત્પાદક સભાસદોની ૧૫(પંદર) બેઠકો તથા બીન ઉત્પાદક જુથની સામાન્ય સભાસદોમાંથી ૧ (એક) અને કો .ઓ.સોસાયટીઝ તથા ખેડૂતોની સ્થપાયેલી ફ્રાં. ઓના જુથમાંથી ૧ (એક) મળી કુલ ૧७(સત્ત૨) બેઠકો માટે સભ્યોની ચુંટણી કરવાની થાય છે. આ સાથે અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલ મતદાર મંડળોની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

ः अनुसुधि ः

(અ) ઉત જુથ	પાદક જુશ:- મતદાર મંડળનું નામ	जेठ न्मी संज्या	બેઠકની વિગત
(9)	બલેશ્વર	09	સામાન્ય બેઠક
(5)	બગુમરા	09	સામાન્ય બેઠક
(3)	856	09	સામાન્ય બેઠક
(8)	મોતા	09	સામાન્ય બેઠક
(4)	સેવણી	09	સામાન્ય બેઠક
(ξ)	ઉભેળ	09	સામાન્ય બેઠક
(v)	સણીયા હેમાદ	09	સામાન્ય બેઠક
(८)	પુણા	09	સામાન્ય બેઠક
(∈)	કુંભારીય	09	સામાન્ય બેઠક
(90)	મોહણી	09	સામાન્ય બેઠક
(99)	ala	09	સામાન્ય બેઠક
(92)	દિગસ	09	સામાન્ય બેઠક
(여) (여	। ઉત્પાદક જુથ		
(9)	બીન ઉત્પાદક વ્યક્તિ સભાસદોના જુથમાંથી	09	સામાન્ય વ્યક્તિ પ્રતિનિધિ
(5)	કો.ઓ.સોસાયટીઝ તથા ખેડૂતોની સ્થપાયેલી ક્યું.ઓના જુથમાંથી	09	મંડળી પ્રતિનિધિ
(১) সেবা	મત બેઠક જુથ		
(9)	મહિલા વિભાગ-૧ (૧ થી ૬ જુથ પૈકી)	09	સ્ત્રી અનામત
(5)	મહિલા વિભાગ-૨ (७ થી ૧૨ જુથ પૈકી)	09	સ્ત્રી અનામત
(3)	અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના સભાસદ (૧ થી ૧૨ જુથ પૈકી)	09	અનુસુચિત જનજાતિ
	(원) + (단) + (윤) 레 윤덕 9년	બેઠકો	700

(અ) + (બ) + (ક) ની કુલ ૧७ બેઠકો

-ઃ ચૂંટણીનો કાર્યક્રમ :-

સંસ્થાનું સરનામું:- શ્રી ચલચાણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., મુ.પો. ચલચાણ, તા.પલસાણા, જી.સુરત

ਘ. ਗੰ.	વિગત	તારીખ	સમય
q	ઉમેદવારી પત્રો મેળવવા માટેની તારીખ, સમય અને સ્થળ	૦७-૧૧-૨૦૨૦ થી ૦૯-૧૧-૨૦૨૦	૧૧-૦૦ થી ૧૫-૦૦ કલાક સુધી શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., ચલથાણ
૨	ઉમેદવારીપત્રો રજુ કરવા માટેની તારીખ, સમય અને સ્થળ.	૦૯-૧૧-૨૦૨૦ થી ૦૯-૧૧-૨૦૨૦	૧૧-૦૦ થી ૧૫-૦૦ કલાક સુધી શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., ચલથાણ
3	મળેલા ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ, સમય અને સ્થળ	૦૯-૧૧-૨૦૨૦ બપોરે ૧૬-૦૦ કલાક પછી શ્રી ચલથણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકાર મંડળી લી., ચલથણ	
X	ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ, સમય અને સ્થળ	90-99-2020	૧૧-૦૦ કલાકથી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી, શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., ચલથાણ
ч	માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ, સમય અને સ્થળ	90-99-2020	અ.નં.૪ ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રથળઃ અ.નં.૩ મુજબના સ્થળે
ξ	ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાની તારીખ, સમય અને સ્થળ	૧૧-૧૧-૨૦૨૦ થી ૧૩-૧૧-૨૦૨૦	૧૧-૦૦ થી ૧૫-૦૦ કલાક સુધી શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., ચલથાણ
G	હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ, સમય, સ્થળ	93-99-2020	૧૬-૦૦ કલાક પછી સ્થળઃ અ.નં. ૩ મુજબના સ્થળે
۷	मतहान ९३री होय तो मतहाननी तारीफ, समय अने खण.	२७-ঀঀ-२०२०	સવારે ૮-૦૦ કલાક થી ૧७-૦૦ કલાક સુધી સ્થળઃ નિયત કરેલ મતદાન મથક ઉપર
€	મત ગણતરી માટેની તારીખ, સમય અને સ્થળ	૨∈-૧૧-૨૦૨૦	૯-૦૦ કલાકથી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી શ્રી ચલથાણ વિભાગ સહકારી ખાંડ ઉધો મંડળી લી., મુ. ચલથાણનો હોલ.
90	મતદાનનું પરિણામ જાહેર કરવાની તારીખ	૨૯- 99-२०२०	અ.નં. લ્ની કાર્યવાહી પુર્ણ થયેથી.

ઉત્પાદક તથા બીન ઉત્પાદક જુથનાં ઉમેદવારીપત્રો ચુંટણી અધિકારી અને ચૂંટણી સબ કમિટિ, શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., યલથાણની કચેરીએ યુંટણી કાર્યક્રમમાં જણાવેલ તારીખ અને સમય દરમ્યાન આપવામાં આવશે અને અ.નં. ૨ માં જણાવેલ તારીખ અને સમય સુધી સ્વીકારવામાં આવશે.

કાર્યક્રમમાં જણાવેલ અ.નં. ૧,૨,૩,૫,૬ અને ७ ની કાર્યવાહી યુંટણી અધિકારી અને યૂંટણી સબ કમિટિ શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., ચલથાણનાએ કરવાની રહેશે તથા અ.નં.૪,૯ અને १०नी क्षर्यवाही यूंटणी अधिकारी अने यूंटणी सज क्रिंगिट श्री यतथाण विભाग जांड ઉद्योग सहकारी મંડળી લી., ચલથાણની હાજરીમાં કરવામાં આવશે.

(3) उमेहवारे उमेहवारी पत्र साथे इ.२५००/- डीपोजीट तरीक्षे क्रमा क्र्याववानी रहेशे तेमक्र अनुसुचित क्राति/ અનુસૂચિત જનજાતિ અને મહિલા ઉમેદવાર માટે રૂ.૧૦૦૦/- ડીપોઝીટ તરીકે જમા કરાવવાની રહેશે.

તા. 03/૧૧/૨૦૨૦ यसयाध-३६४ ३०५ (મનહર એલ પટેલ) ચૂંટણી અધિકારી

શ્રી ચલચાણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.,

(यूंटणी सज इभिटिना आदेशथी) નોંધઃ- પ્રવર્તમાન વૈશ્વિક કોરોના મહામારીના સંજોગોને ધ્યાન લઇ વર્તમાન ચૂંટણીના દરેક તબક્કે દરેક

વ્યક્તિએ કોવિડ-૧૯ અંગેની સરકારશ્રીની ગાઇડલાઇનનો ફરજયાતપણે અમલ કરવાનો છે. કંપની રોક્રેટરી Printed by Manojbhai Laljibhai Mistry at GUARDIANPRESSB-17/2, Hojiwala Industrial Estate, Sachin-Palsana Road, Near Sachin, Surat on behalf of owners Manojbhai Laljibhai Mistry & Published by Manojbhai Laljibhai Mistry at Guardian House, Surman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry at Guardian House, Surman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry at Guardian House, Surman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry at Guardian House, Surman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry at Guardian House, Surman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry at Guardian House, Surman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Lal

આજ રોજ તા. ૨૩/૧૦/૨૦૨૦ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરીને આપ્યો. હુકમથી :- સહી (એસ.એમ.રજવાડી) સબ્ર ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાયબ કલેકટર સીદી પ્રાંત, સુરત dl. 28/90/2020

આથી આ જાહેર નોટીસથી લાગતા-વાળગતા તમામ ઇશ્વમાને જણાવવામાં આવે છે કે, સદર, અરજીમાં અરજદાસ્ત્રી અતુલ ક્ષિવરામ આહિર, રહે. પવ, નાગરોન નગર, પાંડેસરા, સુરતના અરજદાર પોતે અતુલ ક્ષિવરામ આહિર, રહે. પવ, નાગરોન નગર, પાંડેસરા, સુરતના ખાતે થયેલ છે અને તેઓના જન્મની નોંઘણી જેન્તે વખતે કાયદાથી અજાણ હોઇ ભૂલ અને શરતચૂક્યો કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અંગ્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સંદર જન્મની નોંઘણી કરાવવા આપ્રામાવાળાને હુકમ કરવા સામે કોઇ પણ ઇશ્વમને વાંઘો કે તકરાર હોય તો અંગ્રેની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-30 માં વાંઘો રજૂ કરવો. જો વાંઘો નહીં આવે તો વાંઘો નથી, તેમ માની આગળાની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા-વાળગતાં ઇશ્વમોએ નોંધ લેવી. आજ रोજ ता. २६/१०/२०२० ना रोજ भारी सही तथा डोर्डनो सिस्डो डरीने आयो. हुङभवी (अस.सेम.रुपयाडी)

સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાયબ ક્લેક્ટર, સીટી પ્રાંત, સુરત

રિક્લાચરમેન્ટ્સ) રેગ્યુલેશન ૨૦૧૫ અંતર્ગત નોટીર આપવામાં આવે છે કે વર્ષ ૨૦૨૦ ના નવેમ્બર મહિનાના ૧૧ મા દિવસે બુધવાર ના રોજ કંપન ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મિટીંગ યોજવામાં આવી છે જેમાં સપ્ટેમ્બર ૩૦,૨૦૨૦ ના રોજ પુરા થત ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડઅલોન તથા કોન્સોલીડેટ્ડ મનઓડીટેડ આર્થિક પરિણામો પર વિચારણા કરી મંજુરી આપવા માં આવશે. કથીત નોટીસ કંપની ની વેબસાઇટ

www.mlpl.biz તેમજ શેર બજારો ની વેબસાઇટ oww.naeindia.com પરથી પણ મેળવી શકાશે. વતી મહેશરી લોજીસ્ટીક્સ લિમિટેડ

તારીખ:03.99.૨૦૨૦ ના ન્કુલા વામતિ ક્રિષ્ણ

વિરૂદ્ધ

કાર્ચવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા-વળગતા ઈસમોએ નોંધ લેવી.